



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૧૦/૨૦૧૮ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૩૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૫ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૪૦ લીટર દેશી દારૂ અને ૧૧૨ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૯ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૧૬,૬૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૩૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૦૩૫/૧૮

**સોલા હાઈકોર્ટ:** ધર્મેશભાઈ કાળુજી ઠાકોર (રહે. ઘાટલોડીયા ચાણક્યપુરી ઓવરબ્રીજ નીચે ઘાટલોડીયા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૧૦/૧૮ કલાક ૫/૦૦ થી ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાની સ્ટોપર ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન નંગ-૩ અને રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.મેઘાણી ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૦૩૬/૧૮

**આનંદનગર:** મોતીબહેન વા/ઓ નારણભાઈ મોકરીયા (ઉ.વ.૬૨) (રહે. શિવમ પ્રાયોરી ટોરેન્ટ પાવર સ્ટેશન સામે મકરબા) તા.૧૪/૧૦/૧૮ સાજના ૭/૧૫ વાગ્યાના સુમારે આનંદનગર કેશર પાર્ટી પ્લોટ પાસે દેવપ્રિય બંગલો નં-૩૬ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ મોતીબહેનના ગળામાંથી સોનાની માળા કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ મોતીબહેન મોકરીયાએ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.જાદવ ચલાવે છે.

માધવપુરા: મનોરમાબહેન વા/ઓ કૈલાશચન્દ્ર ચંડક (ઉ.વ.૬૫)(રહે. સ્પેક્ટ્રમ ટાવર શાહીબાગ) તા.૧૬/૧૦/૧૮ કલાક ૬/૪૫ વાગ્યાના સુમારે સ્વામીનારાયણ મંદિર પાસે અંબાજી માતાજીના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ મનોરમાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ મનોરમાબહેન ચંડકે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એન.પટેલ ચલાવે છે.

વિજ ક્રંટ લાગતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૦૩૭/૧૮

ચાંદખેડા: નાનુરામ મોહનરામ ગરાસિયા (ઉ.વ.૨૧) (રહે.સ્ટેટસ આઇકોન ઝુંડાલ સર્કલની બાજુમા ચાંદખેડા) તા.૧૭/૧૦/૧૮ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે ચાંદખેડા સ્ટેટસ આઇકોનની સાઇટના સાતમા માળે ઇટો આપવાનું મજૂરી કરતા હતા ત્યારે ઇટો ઉપર પડેલ ઇલેક્ટ્રીક વાયર પકડી બાજુમાં મુકવા જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના ડૉ.શ્રીએ નાનુરામ ગરાસિયાને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.મહેન્દ્ર ભગવાનરાવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.